



# ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ - કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર, નાગપુર

ICAR-Central Institute for Cotton Research, Nagpur

An ISO 9001:2015 Certified Organization



## ૨૪ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૭ દરમ્યાન કપાસની ખેતી પદ્ધતિ માટે રૂ મી અઠવાડિક સલાહ

ગુજરાત	છેલ્લા અઠવાડિયામાં પડેલ ખરેખર વરસાદ (મીભી)					આગામી અઠવાડિયા માટે સુચિત / પુર્વાનુમાન વરસાદ (મીભી)				
	ઓક્ટોબર					ઓક્ટોબર				
	૨૦	૨૧	૨૨	૨૩	૨૪	૨૫	૨૭	૨૮	૨૯	૩૦
	અમરેલી	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	ભાવનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	જામનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	રાજકોટ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	જુનાગઢ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	સાબરકાંઠા	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	સુરેન્દ્રનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	અમદાવાદ	૦	૦		૦	૦	૦	૦	૦	૦
	વડોદરા	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	પાટણ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	મહેસૂસાણા	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
કુલ પડેલ વરસાદ અને પ્રમાણિત રંગ	૦.૧ થી ૨.૪ મીભી	૨.૫ થી ૧૫.૫ મીભી	૧૫.૬ થી ૬૪.૪ મીભી	૬૪.૫ થી ૧૧૫.૫ ૧૧૫.૫	૧૧૫ થી ૨૦૪.૪ મીભી					
પડેલ વરસાદનું વર્ગીકરણ	ખૂબ જ ઓછો વરસાદ	ઓછો વરસાદ	મધ્યમ વરસાદ	ભારે વરસાદ	અતિ ભારે વરસાદ					

### પાક પરિસ્થિતિ :

સુરત ખાતે વાવણી કરેલ પાક ૧૧૮ થી ૧૨૪ દિવસનો જીડવા બેસાણની અવસ્થાએ છે. લીલાં તડતડીયા, મોલોમશી અને ગુલાબી ઈયળની વસ્તીએ આર્થિક ક્ષમ્ય માત્રા વટાવેલ છે. ખેતરમાં મીલીબગની વસ્તી છૂટી-છવાયી જોવા મળેલ છે. કોરીનોસ્પોરા ખૂણિયાં ટપકાંનો રોગ અને લાલ પાન થવાનો રોગ ઓછા પ્રમાણમાં અને પાનના ખૂણિયાં ટપકાંનો રોગ વધુ પ્રમાણમાં નોંધાયેલ છે.

જુનાગઢ ખાતે વાવણી કરેલ પાક ૧૧૮ દિવસનો કુલ અને જીડવા વિકાસની અવસ્થાએ છે. પિયત આપવાની અને દવા છાંટવાની કામગીરી થયેલ છે. કેટલાંક સ્થળોએ સફેદ માખીનો ઉપદ્રવ આર્થિક ક્ષમ્ય માત્રાથી વધુ નોંધાયેલ છે. ફેરોમોન ટ્રેપમાં ગુલાબી ઈયળનાં કુંદા પકડવામાં આવેલ છે. કેટલાંક ખેતરોમાં કોરીનોસ્પોરા પાનનાં ટપકાંનો રોગ અને ગ્રે મીલદયુ જોવામાં આવેલ છે જ્યારે ઘણાં ખેતરોમાં સુકારો – પેરા વીલ્ટ નોંધવામાં આવેલ છે.

### સલાહ :

સુરત ખાતે બીટી કપાસમાં લાલ પાન થવાની સમસ્યાનાં નિયંત્રણ માટે સંપુર્ણ ખેતરમાં કુલોનું બેસાણ વધુ હોય ત્યારે અને જીડવા વિકાસની અવસ્થાએ એમ બે વખત ૧૫ દિવસનાં આંતરે મેળેશિયમ સલેટ @ ૧ % + યુરીયા ૧% આપવું. જીડવાનું બેસાણ સુધારવા અને કુલોનું ખરણ અટકાવવા પોટેશિયમ નાઈટ્રોટ્રેપ (૧ ઉંસ:૪૫) @ ૨ % એટલે કે ૨ કિલો પોટેશિયમ નાઈટ્રોટ્રેપ ૧૦૦ લી. પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો અથવા નેથેલીક એસેટીક એસીડ ૪.૫ એસેટેલ @ ૪.૦ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં નાંખી છાંટવું. મીલીબગનાં છૂટાછવાયા પજમાન પાકો અથવા નિંદામણો અને અસરગ્રસ્ત છોડોને ઉખાડી તેનો નાશ કરવો. જો ચુસીયાં પ્રકારની જીવાતો તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો ફ્લોનીકામીડ ૫૦ ડબલ્યુજી @ ૪ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી @ ૩ ગ્રામ અથવા બુગ્રોફેઝીન ૨૫ ઈસી @ ૨૦ મીલી / ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવો. ગુલાબી ઈયળની મોજણી માટે ફેરોમોન ટ્રેપ (પ પ્રતિ હેક્ટર) લગાડવા. પાક ૧૨૦ દીવસથી વધુનો થયો હોય જ્યાં ગુલાબી ઈયળ તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે (૧૦% ફળાઉ ભાગોમાં નુકશાન) ત્યાં સાયપરમેથીન ૨૫ ઈસી @ ૧૦ મીલી અથવા લેમા સાયપેલોથીન ૫ ઈસી @ ૧૦ મીલી અથવા ડેલ્ટામેથીન ૨.૮ ઈસી @ ૧૦ મીલી અથવા ફેનવેલેરેટ ૨૦ ઈસી @ ૧૦ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવો. સુકારો અને મૂળનાં કોહવારા રોગનાં વ્યવસ્થાપન (દેશી કપાસ) માટે ઉપક્રમિત છોડોની આજુબાજુ કાર્બેન્ડેજીમ ૫૦% વે.પા. @ ૧.૨ ગ્રામ/ લી. અથવા ટ્ર્યાયકોડર્મા હરસીયમ અથવા ટ્ર્યાયકોડર્મા વિરીડી ૧૦ ગ્રામ/ લી. પાણીમાં આપવું અને ટેશી કપાસમાં ફ્યુઝારીયમ કુંગથી થતાં સુકારો રોગનાં નિયંત્રણ માટે સંક્રમીત છોડથી ૧ મી.ની ત્રિજ્યામાં રહેલ તંદુરસ્ત છોડોમાં પણ સદર માવજત આપવી. જીડવાનો સરો અને ખૂણિયાં ટપકાંનો રોગ આવતો અટકાવવા માટે કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ ડબલ્યુપી/ ડબલ્યુજી @ ૨૫–૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે આપી વ્યવસ્થાપન કરવું. છોડમાં જોવા મળતા કોરીનોસ્પોરા, અલ્ટરનેરેનીયા કુંગથી થતાં ટપકાંઓ તથા મૂળનાં કોહવારા અને અન્ય બ્લાઈટ જેવાં રોગોનાં વ્યવસ્થાપન માટે કાર્બેન્ડેજીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુપી @ ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઓલ ૨૫ ઈસી @ ૧૦ મીલી અથવા કાર્બેન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૪ ગ્રામ અથવા ફલુક્ષાપાયરોક્ષાડ ૧૬૭ ગ્રામ/ લી. + પાયરાકલોસ્થોથીન ઉત્તર ગ્રામ/ લી. એસસી @ ૬ મીલી અથવા

એજોક્ષાસ્ટ્રોભીન ૧૮.૨% ડબલ્યુ/ ડબલ્યુ + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% ડબલ્યુ/ ડબલ્યુ એસસી @ ૧૦ મીલી અથવા મેટીરામ પ૪% + પાયરોક્લોસ્ટ્રોભીન ૫% ડબલ્યુજી @ ૨૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાની સલાહ આપવમાં આવે છે.

જુનાગઢ ખાતે ખેડુતોને પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૩-૦-૪૫ (અન-પી-કે) @ ૧૦૦ ગ્રામ સાથે મલ્ટી માઈક્રો ન્યૂટ્રીયન્ટ માઈક્રો મીક્સ ગ્રેડ-૪ ૧૫ ગ્રામ ૧૦ લી. પાણીમાં આપવાની સલાહ છે. જો લીલાં તડતડીયા તેની આર્થિક ક્ષમ્ય માત્રા કરતાં વધુ નોંધવામાં આવે તો ફ્લોનીકામીડ ૫૦ ડબલ્યુજી @ ૪ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસશી @ ૩ ગ્રામ પ્રતિ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છાંટવું. સફેદ માખીની વસ્તીને નિયંત્રિત કરવા પાયરીપ્રોક્ષીઝેન ૧૦ ઈસી @ ૨૦ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં અથવા ડાયફેનથ્યુરોન ૫૦ ડબલ્યુપી @ ૨૦૦ મીલી પ્રતિ એકર મુજબ છાંટવું. પાકમાં ગુલાબી ઈયળનાં કુદાની મોજણી કરવા માટે એકર દિંદ ૨ ફેરોમોન ટ્રેપ લગાડવા અને પાકમાં કુદાની વસ્તીની નોંધણી કરવી. ખેતરમાંથી ગુલાબી ઈયળથી ઉપદ્રવિત કળી અને રોઝેટ કુલો (ઉપદ્રવિત કુલો) બેગા કરી નાશ કરવો જેથી ગુલાબી ઈયળની વસ્તીનો ફેલાવો અટકે. જો ગુલાબી ઈયળનો ઉપદ્રવ તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો એમામેક્ટીન બેન્જોએટ ૫ એસશી @ ૫ ગ્રામ અથવા પ્રોફેનોઝેસ ૫૦ ઈસી @ ૩૦ મીલી અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસસી @ ૧૦ મીલી પ્રતિ ૧૦ લી. પ્રમાણે પાણીમાં નાંખી છંટકાવ કરવો. ઉપલબ્ધી હોય તો ગુલાબી ઈયળનાં જૈવિક નિયંત્રણ માટે ઈડાના પરજીવી ટ્રાયકોગ્રામેટોઇડી બેકટરી ૧.૫ લાખ પ્રતિ હેક્ટર છોડવા. કુગથી થતાં રોગો અને કોરીનોસ્પોરા પાનનાં ટપકાનાં રોગનાં નિયંત્રણ માટે કાર્બોન્ડેજીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુપી @ ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી @ ૧૦ મીલી અથવા કાર્બોન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૪ ગ્રામ અથવા ફલુક્ષાપાયરોક્ષાડ ૧૫૭ ગ્રામ/ લી. + એજોક્ષાયસ્ટ્રોભીન ૧૮.૨% ડબલ્યુ/ ડબલ્યુ + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% ડબલ્યુ/ડબલ્યુ એસસી @ ૧૦ મીલી અથવા મેટીરામ પ૪% + પાયરોક્લોસ્ટ્રોભીન ૫% ડબલ્યુજી @ ૨૦ ગ્રામ/ લી. પાણીમાં ભેગુ કરી છાંટવું. સુકારા અથવા મૂળનાં કોહવારા રોગનાં યોગ્ય નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી છાણિયુ ખાતર અથવા સેન્દ્રીય ખાતરમાં ભેળવી જમીનમાં ૨.૫ કિલો / હે. મુજબ આપવું અથવા કાર્બોન્ડેજીમ ૫૦ વેપા. @ ૧૨ ગ્રામ/ ૧૦ લી. અને યુરિયા ૧.૫ ટકા પાણીમાં ભેળવી સંક્રમિત છોડોનાં મૂળ વિસ્તાર નજીક દરેકવું.

કપાસ ઉત્પાદનની તાંત્રિકતા આધારિત વિસ્તૃત માહિતી દા.ત. જમીનની પસંદગી, જાતો/ સંકરો, ખાતર આપવાની પદ્ધતિ, વાવણીની રીત, પિયત પદ્ધતિઓ, નિંદામજ્ઞ, કિટકો અને રોગોનું વ્યવસ્થાપન વિગેરેની માહિતી એન્ડ્રોઇડ આધારીત CICR Cotton App. કે જે ICAR-CICR, નાગપુર દ્વારા તૈયાર કરેલ છે. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાંથી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય છે. વધુમાં, પાક વૃદ્ધિ અવસ્થા અને હવામાન આધારિત અહીંવાડિક સલાહ ICAR-CICR, નાગપુરની વેબસાઈટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે જેનો લાભ ખેડુતો લઈ શકે છે.